

## EASY LEVEL

## PATTERN: Emotion and feeling sentences

## Learn: Expressing Feelings

Express how you feel

## 1 Read These Sentences ( આ વાક્યો વાંચો )

Read each Gujarati sentence and its English translation aloud.

## 1 હું ખુશ છું.

"I am happy."

## 2 તું દુઃખી છે.

"You are sad."

## 3 મને ભૂખ લાગી છે.

"I am hungry."

## 4 મને તરસ લાગી છે.

"I am thirsty."

## 5 મને ઊંઘ આવે છે.

"I am sleepy."

## 6 મને ડર લાગે છે.

"I am scared."

## 7 મને ગુસ્સો આવે છે.

"I am angry."

## 8 મને થાક લાગ્યો છે.

"I am tired."

**1 Fill in the Blanks** ( ખાલી જગ્યા પૂરો )

Complete each Gujarati sentence by filling in the blank.

**Q1** હું \_\_\_\_\_ છું.

Hint: I am \_\_\_\_.

Answer: પુરુષ

**Q2** મને \_\_\_\_\_ લાગી છે.

Hint: I feel \_\_\_\_.

Answer: ભૂખ

**Q3** મને \_\_\_\_\_ આવે છે.

Hint: I feel \_\_\_\_.

Answer: ઊંઘ

**Q4** તું \_\_\_\_\_ છે.

Hint: You are \_\_\_\_.

Answer: દુઃખી

**2 Translate to Gujarati** ( ગુજરાતીમાં અનુવાદ કરો )

Translate each English sentence to Gujarati. Hint shown in light green.

**1** I am hungry.

→ મને ભૂખ લાગી છે.

**2** You are happy.

→ તું ખુશ છે.

**3** She is sad.

→ તે દુઃખી છે.

**1 Build Your Own Sentences** ( પોતાના વાક્યો બનાવો )

Write 5 Gujarati sentences using the pattern "Expressing Feelings".

1 \_\_\_\_\_

2 \_\_\_\_\_

3 \_\_\_\_\_

4 \_\_\_\_\_

5 \_\_\_\_\_

**2 Write a Mini Story** ( નાની વાર્તા લખો )

Combine 3-4 sentences from above to write a short story (3-4 lines).

—■ Write your story here:

\_\_\_\_\_

\_\_\_\_\_

\_\_\_\_\_

\_\_\_\_\_

\_\_\_\_\_